

Covid-19 રસીકરણ
પ્રવાસી સમુદાય સભ્યો માટે તમારા અધિકારો જાણો

- નાગરિકત્વની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના (ભલે તમે બિનદસ્તાવેજી કૃત હોવ તો પણ), યુ.એસ.માં દરેક જણ માટે આ રસી વિના મૂલ્યે ઉપલબ્ધ છે. વીમા કાર્ડની વિનંતી કરવામાં આવી શકે છે પરંતુ રસી મેળવવા માટે તે જરૂરી નથી.
- રસી લેવા માટે Social Security Number (સોશિયલ સિક્યોરિટી નંબર) ની જરૂર નથી. જો કોઈ પ્રદાતા તમારી પાસે social security number માંગે અને તે તમારી પાસે ન હોય અથવા તેને શેર કરવામાં તમે ખચકાટ અનુભવતા હોવ, તો તમે જવાબ આપી શકો છો કે તે તમારી પાસે નથી અથવા તેને શેર કરવામાં આરામદાયક અનુભવતા નથી.
- તમારી રસી પ્રાપ્ત કરવા માટે તમને તમારી ઓળખ આપવાનું કહેવામાં આવી શકે છે. જો તમારી પાસે સ્ટેટ આઈડી/ડ્રાઇવર લાઇસન્સ ન હોય, તો તમને તમારા વર્તમાન સરનામાં સાથેનો એક પત્ર, નિવેદન અથવા યુટિલિટી બિલ અથવા કોઈ ચર્ચ, સંગઠન અથવા પ્રદાતા તરફથી એક પત્ર પ્રદાન કરવાનું કહેવામાં આવશે જે તમને ઓળખતા હોય અને એવું પ્રમાણિત કરે કે તમે વોશિંગ્ટન રાજ્યમાં રહો છો અથવા કામ કરો છો.
- Centers for Disease Control and Prevention (સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) અને યુ.એસ. Department of Health and Human Services (ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ) એ ભાર મૂક્યો છે કે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ ફક્ત જાહેર આરોગ્યના હેતુઓ માટે જ કરવામાં આવશે. વ્યક્તિગત ડેટાનો ઉપયોગ ઇમિગ્રેશન અમલવારી સહિત દિવાની અથવા ફોજદારી કાર્યવાહી માટે કરી શકાશે નહીં.
- કોઈપણ રીતે રસી લેવી તેને પબ્લિક ચાર્જ તરીકે ગણવામાં આવશે નહીં. રસીનો ઉપયોગ કરવાથી રહેઠાણ અને/અથવા નાગરિકતાનો દરજ્જો મેળવવામાં કોઈ અવરોધ ઉભો થશે નહીં.
- ઇમિગ્રેશન સ્થિતિ વિશે કોઈએ પૂછવું ન જોઈએ, પરંતુ જો તમને તમારી ઇમિગ્રેશન સ્થિતિ વિશે પૂછવામાં આવે તો મૌન રહો.
- ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લીધા વગર કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકે છે. રસી લેવા માટે તમારી ઇમિગ્રેશન સ્થિતિના પુરાવાને આપવાની આવશ્યકતા નથી.

Legal Counsel for Youth and Children (LCYC) (લીગલ કાઉન્સિલ ફોર યૂથ એન્ડ ચિલ્ડ્રન) અને Northwest Health Law Advocates (NoHLA) (નોર્થવેસ્ટ હેલ્થ લૉ એડવોકેટ્સ) નો વિશેષ આભાર

આ દસ્તાવેજનું નિરીક્ષણ WA DOH (ડીઓએચ) દ્વારા કરવામાં આવ્યું છે

